



RAN-2301001201010571

F.Y.B.A. (Sem. - I) Examination November - 2025
Economics (Paper - I) Major - 1 : Micro Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) બધા પ્રશ્નો ફરજિયાત છે.
All Question Compulsory
- (3) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate Full marks of the Questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેનાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ) (10)

1. પ્રો. રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો.
2. માંગ વિધેય એટલે શું? તેનું સૂત્ર લખો.
3. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું?
4. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો દર્શાવો.
5. સીમાન્ત અવેજીનો દર એટલે શું?
6. તટસ્થ રેખાનાં લક્ષણો લખો.
7. ખર્ચના પ્રકારો જણાવો.

પ્ર. 2. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, મહત્વ અને મર્યાદાઓ ચર્ચો. (13)

અથવા

પ્ર. 2. અ. માંગનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. (07)

બ. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતાં પરિબળો ચર્ચો. (06)

પ્ર. 3. બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ વિગતે સમજાવો. (13)

અથવા

પ્ર. 3. અ. તૃષ્ટિગુણ એટલે શું? તૃષ્ટિગુણના પ્રકારો સમજાવો. (07)

બ. ટૂંકાગાળાના ખર્ચ અને ઉત્પાદનનાં સંબંધો ચર્ચો. (06)

પ્ર. 4. ટૂંકનોંધ લખો (ગમે તે બે) (14)

1. પ્રો.જે.કે. મહેતાના આર્થિક વિચારો
2. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો
3. સીમાન્ત અવેજીના ઘટતા દરનો નિયમ
4. લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા

ENGLISH VERSION

- Q. 1. Answer the Following Questions briefly. (10)**
1. Give the definition of economics given by Prof. Robbins.
 2. What is Demand Function? Write this formula.
 3. What is Macro Economics?
 4. Indicate the types of income elasticity of demand.
 5. What is marginal rate of substitution?
 6. Write the characteristics of Indifference curve.
 7. State the types of Cost
- Q. 2. What is Micro Economics? Discuss the scope, Importance and limitation of Micro Economics. (13)**
- OR**
- Q. 2. (A) Explain the law of demand with help of diagram. (07)**
(B) Discuss the factors affecting price elasticity of demand (06)
- Q. 3. Explain the details of law of variable proportion. (13)**
- OR**
- Q. 3. (A) What is utility? Explain the types of utility. (07)**
(B) Discuss the relationship of cost - output under short run. (06)
- Q. 4. Write Short Note (Any two) (14)**
1. Prof. J.K. Mehta's Economics thought.
 2. Types of Price Elasticity of Demand.
 3. Law of diminishing Marginal rate of substitution.
 4. Long run Average Cost Curve
-